



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સમૃદ્ધિ", ૪થો માળ, મક્કાઈ પુલ, નાનપુરા, સુરત - ૩૯૫ ૦૦૧

ફોન નં. ૨૨૯૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

રેફ નં.

તા : ૧/૫/૨૦૨૧

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(ડે. સેક્રેટરી)

ચેમ્બર દ્વારા ડો. જયનારાયણ વ્યાસ સાથે 'ગુજરાત અને ગુજરાતની અસ્મિતા' વિશે વેબિનાર યોજાયો

સુરત. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧ મે ૨૦૨૧ના રોજ 'ગુજરાત અને ગુજરાતની અસ્મિતા' વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતને ખૂબ જ નજીકથી ઓળખનારા ડો. જયનારાયણ વ્યાસે સંઘર્ષ, સમન્વય, સંવાદ અને સિદ્ધિથી ગુજરાતની અસ્મિતાની વિસ્તૃત સમજણ આપી હતી.

ડો. જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાને શબ્દોથી વર્ણવા જેવી નથી. તેના રગેરગમાં, ટીપેટીપે અને રૂવાડે રૂવાડે સંસ્કારિતા છે. ગુજરાતમાં ધ્યેય સાથે મથવાની અસ્મિતા છે. રણછોડલાલ રેંટિયાવાળાએ અમદાવાદમાં પહેલી કાપડ મીલ નાંખી હતી અને ત્યારબાદ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનો પાયો નંખાયો હતો. તે સમયે પણ અમદાવાદ ગુજરાતનું આર્થિક વ્યવસ્થાપનનું કેન્દ્ર હતું. જ્યારે સુરત, ભરૂચ અને ઘોઘા એ ગુજરાતનાં મુખ્ય બંદર હતાં.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય કોમવાદનું વેર સાંભળ્યું નથી. અકબર રાજાનાં રાણી જોધાબાઈને શાંતિદાસ જેવા શેઠે આશ્રય આપ્યો હતો. ભરૂચના ઐયાજ મલેક જીવ્યા ત્યાં સુધી પોર્તુગીઝોને ગુજરાતની ઘરતી પર પગ મુકવા દીધો નહીં. ગુલામમાંથી સેનાપતિ બનેલા બાબા ઘોરે અકીક ઉદ્યોગની સ્થાપના કરી હતી. ઔરંગઝેબ

દ્વારા જ્યારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે સુરતમાં જૈન અને વૈષ્ણવ મહાજનોના આગેવાનો વીરજી વોરા અને ભીમજી પારેખે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરી ઔરંગજેબને નમાવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી હતી. તેમણે નાનજી કાળીદાસ, કાનજી માલમ અને રામજી માલમનો ઉલ્લેખ કર્યો હતો.

વઘુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતા એટલે કડ્ડણ છે. મહાત્મા ગાંધીજીએ જ્યારે દેશમાં લોકોની પરિસ્થિતિને નજીકથી જોઈ ત્યારે તેમણે પોતાના શરીરના અડધા કપડાનો ત્યાગ કર્યો હતો. જ્યારે મારા દેશમાં લોકોને તન ઢાંકવા પૂરતાં કપડા નથી મળતા ત્યારે હું કપડાંનો વૈભવ કરું તે યોગ્ય નથી એવું કહીને મહાત્મા ગાંધીએ અડધા કપડાનો ત્યાગ કર્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની પુત્રીની સાદાઈનો પણ દાખલો આપ્યો હતો.

તેમણે કહ્યું કે, અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં નાંખી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉઠી જવાની સ્થિતિમાં હતી ત્યારે સુરતના આત્મારામ ભુખણની કંપનીએ અંગ્રેજોને રૂપિયા એક લાખની આંટ આપી હતી. સુરતના ભીમજી પારેખ એ પ્રિન્ટીંગ મશીન લઈ આવ્યા હતા. જ્યારે સુરતના બીજા મહાજન વીરજી વ્હોરાએ આ દેશમાં ચા અને કોફી આયાત કરવાનું શરૂ કર્યું હતું. વીર નર્મદે સુરતને સરસ્વતીને ખોળે માથું મૂકી જીવવાની ખુમારીનો પરિચય આપ્યો હતો. ચં.ચી. મહેતાએ પોતાના પુસ્તકમાં જૂના અંબાજી માતાના મંદિરે જે ગરબા રમાતા હતા તેનું રસપ્રદ વર્ણન કર્યું છે.

વઘુમાં તેમણે કહ્યું કે, અસ્મિતા એટલે તમારી જાતને સિદ્ધાંતોમાં ઓગાળી દેવી. રસિકલાલ પરીખ જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે પોલીસની સાથે બહારવટીયાને પકડવા રિવોલ્વર લઈને પહોંચી જતા હતા. પત્રકારત્વ થકી અમૃતલાલ શેઠે અને સોરઠી ઘરાના ધીંગા સાહિત્યકાર મેઘાણીએ ગુજરાતની અસ્મિતા વધારી છે. ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહજી કે ગોડલનાં ભગવતસિંહજી કે પછી વડોદરાનાં સર સયાજી રાવ ગાયકવાડની રાજ્યવ્યવસ્થા સુશાસનનો પર્યાય બની.

ગાંધીજીનાં અગિયાર મહાવ્રત જેમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું; બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા; એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાંની શીખનું આચરણ એ ગુજરાતની અસ્મિતા છે. ભક્ત કવિ નરસૈયો કે પછી અખો, ગુજરાતની અસ્મિતા છે. વઘુમાં તેમણે કહ્યું કે, ટોળાં ભેગા કરવા એ માનવ સહજ નબળાઈ છે પણ એકલો જાજે રેની માનસિકતા ઉભી કરનાર ગુજરાતની અસ્મિતા છે.

ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું.